



COVID-19 મહામારી દરમિયાન બ્રેમ્પટનમાં વિક્ટોરિયા ડે 2020

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 12, 2020) – આ વર્ષે, વિક્ટોરિયા ડે સોમવાર, મે 18 નાં રોજ યોજાશે.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે અને આપણાં રહેવાસીઓ અને કર્મચારીઓની સુરક્ષા માટે, સીટી હોલ અને સીટી ઓફ બ્રેમ્પટનની અન્ય બધી સગવડો, જેમાં રિક્લેમેશન અને કમ્યુનિટી સેન્ટર્સ અને લાઈબ્રેરીની શાખાઓ સામેલ છે, આગળ સૂચના આપવામાં ના આવે ત્યાં સુધી બંધ રહેશે જેથી COVID-19 નો ફેલાવો રોકવામાં મદદ મળી શકે.

અગ્નિશમન અને કટોકટીની સેવાઓ, ટ્રાફિક સેવાઓ, કાયદાકીય અમલ બજાવણી, રોડ ઓપરેશન્સ, POA કોર્ટ્સ અને સુરક્ષા સેવાઓ સહિતની તમામ નિર્ણાયક સેવાઓનું સંચાલન આપણાં સમુદાયને સહાયરૂપ થવા રાબેતા મુજબ ચાલુ રહેશે.

રહેવાસીઓ કોઈ પૂછપરછો માટે 311 અથવા 905.874.2000 (બ્રેમ્પટન બહારથી) નંબર પર ફોન કોલ કરી શકે છે, Brampton 311 એપનો ઉપયોગ કરી શકે છે (App Store અથવા Google Play પર ઉપલબ્ધ) અથવા www.311brampton.ca ઈમેઈલ સરનામે 311@brampton.ca ઈમેઈલ મોકલી શકે છે. કર મોકૂફ, વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું અને પાર્ક્સ અને સગવડો બંધ થવા જેવી COVID-19 ને સંબંધિત પૂછપરછો સહિત, સીટી ઓફ બ્રેમ્પટન કે રીજીયન ઓફ પીલની કોઈપણ બાબતો માટે અમે 24/7 ઉપલબ્ધ હોઈએ છીએ. વધુ માહિતી મેળવવા વેબસાઈટ www.brampton.ca/covid19 જુઓ.

વિક્ટોરિયા ડે ઉજવો – ઓનલાઈન!

બ્રેમ્પટનવાસીઓને વિક્ટોરિયા ડે પોતાના ઘરે રહીને ઉજવવામાં મદદરૂપ થવા, આપણાં સીટીએ એક ઓનલાઈન હબ બનાવ્યું છે જે કુટુંબ-અનુકૂળ પ્રવૃત્તિઓ, સ્થાનિક રેસ્ટોરન્ટ્સમાંથી ઘરે ફૂડ લઈ જવા ટેકઆઉટ વિકલ્પો, અને વર્ચ્યુઅલ (વાસ્તવિક) આતશબાજી પ્રદર્શનથી ભરપૂર છે, અને SnapdHUB દ્વારા સંચાલિત છે.

રહેવાસીઓને વિક્ટોરિયા ડે પર હેં બ્રેમ્પટનના ભાગ રૂપે સ્થાનિક રેસ્ટોરન્ટ્સમાંથી ઓર્ડર કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે! લેટ'સ ઈટ! ઝુંબેશ એક્સ્પરિયન્સ બ્રેમ્પટન દ્વારા ચલાવવામાં આવે છે. તમારા બેકયાર્ડમાં, તમારા ઘરની ફ્રન્ટ લોન પર, તમારા ડ્રાઈવવેમાં, અથવા ઘરે કોઈપણ જગ્યાએ પિકનિક ગોઠવીને પોતાનો ડાઈનિંગ અનુભવ યાદગાર બનાવો. સોશિયલ મીડિયા પર ફોટા વહેંચો અને ભૌતિક દૃષ્ટિએ અમારી દૂરસ્થ ઉજવણીનો ભાગ બનવા [#BramptonTogether](https://twitter.com/BramptonTogether) નો ઉપયોગ કરો.

વધારે વાસ્તવિકતામાં એક રોમાંચક આતશબાજી અનુભવ મેળવવા સમગ્ર ઓન્ટેરિયોમાં પડોશીઓ સાથે જોડાઓ! વર્ચ્યુઅલ (વાસ્તવિક) આતશબાજી પ્રદર્શન રહેવાસીઓને પરંપરાગત વિક્ટોરિયા ડે આતશબાજી પ્રદર્શન સામે સુરક્ષિત વિકલ્પો આપે છે. વર્ચ્યુઅલ શો ઓનલાઈન રાત્રે 8 વાગ્યે, આતશબાજીનું કાઉન્ટડાઉન રાત્રે 7:50 વાગ્યે શરૂ થશે. સહભાગી રેસ્ટોરન્ટ્સ અને આતશબાજી પ્રદર્શનની લિંક માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/victoriaday.

આતશબાજી સુરક્ષા

વિક્ટોરિયા ડે વર્ષમાં ચાર રજાઓમાંની એક છે જ્યારે ખાનગી મિલકત માટે ટૂંકા-અંતરના ફટાકડાઓ ફોડવાની છૂટ આપવામાં આવે છે, જેમાં બ્રેમ્પટનમાં પરમીટ લેવાની જરૂર પડતી નથી. બાય-લો (પેટા-કાનૂન) હેઠળ, આતશબાજીની પરવાનગી કેનેડા ડે, દિવાળી અને ન્યૂ ઈયર્સ ઈવ (નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ) પણ આપવામાં આવે છે.

ટૂંકા-અંતરના ફટાકડાઓ એ હોય છે જે ત્રણ મીટર (10 ફૂટ) કરતા ઓછું અંતર કાપતા હોય જ્યારે તે છોડવામાં આવે (દા.ત. ફાઉન્ટેઈન્સ, વ્હીલ્સ, ગ્રાઉન્ડ સ્પિનર્સ, સ્પાર્કલર્સ). બ્રેમ્પટનમાં રોકેટ જેવા અન્ય તમામ ફટાકડાંની મનાઈ ફરવામાં આવેલી છે. આ શહેર રહેવાસીઓને યાદ



અપાવે છે કે ફટાકડાઓ સ્ટ્રીટ પર, સાઈડવોક્સ પર, શહેરના પાર્ક્સ કે મ્યુનિસિપલ અથવા સ્કૂલ મિલકતોમાં ફોડવાની પરવાનગી નથી.

ખાનગી મિલકતમાં ટૂંકા-અંતરના ફટાકડાઓ ઉપયોગમાં લેતી વખતે, રહેવાસીઓએ આ સુરક્ષા સાવચેતીઓ અચૂક અનુસરવી રહી:

- પાણી ભરેલું પાત્ર અથવા પાણી ભરેલી હોઝ લાઈન ફટાકડાં હોલવવા પોતાની પાસે ઉપલબ્ધ રાખો.
- સ્પાર્કલર સિવાય, તમારા હાથમાં ફટાકડા ક્યારેય ફોડશો નહિ કે પકડી રાખશો નહીં.
- ફટાકડાં અન્ય લોકો પર ક્યારેય ફેંકશો નહિ કે ચિંધશો નહીં.
- સ્પાર્કલર્સનો ઉપયોગ કર્યા પછી, તેનો નિકાલ કરતા પહેલાં તેને પૂરેપૂરા ઠંડા પાડવા પાણીના પાત્રમાં રાખો
- તમામ ફટાકડાનો નિકાલ કરતા પહેલાં તેને પૂરેપૂરા ઠંડા થવા દો.

દર વર્ષે, ફટાકડા વિક્રેતાઓ ફટાકડા વેચવાનું લાઈસન્સ મેળવે ત્યાર પહેલાં તેઓએ સીટીની તાલીમ લેવી અનિવાર્ય છે. આ વર્ષે, કોઈ તાલીમ યોજવામાં આવી નહિ અને કોઈ લાઈસન્સીસ આપવામાં આવ્યા નહીં. જો રહેવાસીઓ સ્ટોર્સમાં કે બ્રેમ્પટનમાં બીજે ક્યાંય ફટાકડા વેચાતા હોવાનું જુએ તો, તેઓને બ્રેમ્પટન 311 મોબાઈલ એપ, [ઓનલાઈન](#), અથવા 311 નંબર પર કોલ કરીને સર્વિસ બ્રેમ્પટનને જણાવવાનું કહેવામાં આવે છે. જો પ્રતિબંધિત ફટાકડાના ઉપયોગ અથવા COVID-19 ને લીધે પાંચથી વધારે લોકો એકઠા થવાથી રહેવાસીઓ ચિંતિત હોય તો પણ તેઓને સર્વિસ બ્રેમ્પટનનો સંપર્ક કરવાનું કહેવામાં આવે છે.

COVID-19 સુરક્ષા ઉપાયો

આપણાં સમુદાયે COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં સુરક્ષિત રહેવા ધ્યાનમાં લેવા જેવા જરૂરી મહત્વના નિયમો અને નિયમનો અમલમાં છે.

- પીલ પબ્લિક હેલ્થ પીલના રહેવાસીઓ બહાર હોય ત્યારે તેઓને વ્યક્તિઓ વચ્ચે અંતર રાખવા (શારીરિક અંતરનું આચરણ કરવા) પ્રોત્સાહિત કરે છે, જેથી ટોળું ભેગું થતું ટાળવાની ખાતરી કરી શકાય. રહેવાસીઓએ કસરત કરતી વખતે ઘરની નજીકમાં રહેવું જોઈએ અને આવશ્યક કારણોસર પર્યટન સીમિત કરવાનું ચાલુ રાખવું જોઈએ. તબીબી સ્થિતિ, સમાધાનકારી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા અથવા 70 વર્ષ ઉપરની ઉંમરના રહેવાસીઓએ ઘરે રહેવું જોઈએ અને કસરત કરવા અથવા આવશ્યક જરૂરિયાતો માટે ઘરની બહાર એકલા જવું જોઈએ.
- બ્રેમ્પટનમાં 500+ ઉપરાંત તમામ પાર્ક્સ, શહેરની સગવડોમાં રમતના મેદાનો અને પાર્ક્સમાં અન્ય માળખાઓ (સ્ટ્રક્ચર્સ), લીશ-ફી ડોગ પાર્ક્સ, પિકનિક શેલ્ટર્સ (ઉજાણી સ્થાનો), આઉટડોર રમતગમતની સગવડો અને આઉટડોર ફિટનેસ ઈક્વિપમેન્ટ્સ (સ્પોર્ટ્સ ફિલ્ડ્સ, બાસ્કેટ બૉલ અને ટેનિસ કોર્ટ્સ), રિક્લેશન સેન્ટર્સ અને આસપાસની જમીનો, અને પાર્કિંગ લોટ્સ જાહેર જનતા માટે આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી બંધ કરવામાં આવ્યા છે. રહેવાસીઓને બિન-અનુપાલન (નોન-કમ્પ્લાયન્સ) નોંધાવવા 905.874.2111 નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે.
- આ સમયે પગદંડીઓ ખુલ્લી હોવા છતાં, લોકોએ બધાં સમયે અન્ય વ્યક્તિથી (તમારા ઘરમાં ન રહેતી વ્યક્તિથી) 2.0 મીટર દૂર અચૂક રહેવું. ટ્રેઈલ્સનો (પગદંડીઓનો) નકશો જોવા, [અહીં](#) ક્લિક કરો.
- પાંચ કે વધારે લોકો એકઠા થવાનું ટાળો – આ હવે પ્રોવિન્સે અમલી બનાવેલા ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ સિવિલ પ્રોટેક્શન એક્ટ હેઠળ પ્રતિબંધિત છે.
- કૃપા કરી વાપરેલા ફેસ માર્સ્ક્સ, પ્રોટેક્ટિવ ગ્લોવ્સ અને અન્ય ઘરેલું આરોગ્ય સંભાળ ક્યારાને એક થેલીમાં મૂકીને ક્યારામાં તેનો નિકાલ કરીને તે ફેંકી દો.



- બ્રેમ્પટનમાં COVID-19 ઈમરજન્સી પગલાઓના પેટાકાનૂન (બાય-લો) હેઠળ દંડ હવે અમલમાં આવે છે. વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર રાખવાના પગલાઓ ન અનુસરવા બદલ દરેક ગુના માટે વ્યક્તિઓને લઘુત્તમ \$500 અને મહત્તમ \$100,000 સુધીનો દંડ કરવામાં આવી શકે છે. રહેવાસીઓને બિન-અનુપાલન નોંધાવવા 311 નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે.
- અમે આપણાં સમુદાય પર COVID-19 નાં પ્રભાવોથી જ્ઞાત છીએ અને કેટલાક લોકો માટે તે ખાસ કરીને મુશ્કેલભર્યો અને તણાવભર્યો સમય છે. અમે સમુદાયને સહાયરૂપ થવા વિશેષ કર્તવ્ય એકમ (ટાસ્ક ફોર્સ) શરૂ કર્યું છે. આમાં આર્થિક સહાયતા, વડીલોને સહાયતા, જીવાનિયાઓને સહાયતા અને સૌથી નાજુક લોકો માટે સહાયતા સામેલ છે. આ ટાસ્ક ફોર્સિસ અને તેઓ સાથે સંપર્ક કરવાને લગતી વધુ માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ છે, www.brampton.ca/covid19.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ રવિવારના સમયપત્રક પ્રમાણે ચાલુ રહેશે જેમાં વિક્ટોરિયા ડે પર કેટલાક રૂટ રદ કરવામાં આવ્યા છે. નીચે જણાવેલા રૂટ્સ સર્વિસ ચાલુ રહેશે:

1 ક્વીન	11 સ્ટીલ્સ	50 ગોર રોડ
2 મેઈન	14 ટોરબ્રામ	52 મેકમર્ચી
3 મેકલાફ્લિન	15 બ્રેમલી	115 પીયરસન એરપોર્ટ
4 ચિંગકુસી	18 ડિક્સી	501 ઝુમ ક્વીન
5 બોવાર્ડ	23 સેન્ડલવૂડ	502 ઝુમ મેઈન
7 કેનેડી	30 એરપોર્ટ રોડ	511 ઝુમ સ્ટીલ્સ

ટર્મિનલ્સ પર કસ્ટમર સર્વિસ કાઉન્ટર્સ બંધ કરવામાં આવ્યા છે. બ્રેમલી, બ્રેમ્પટન ગેટવે અને ડાઉનટાઉનમાં ટર્મિનલ બિલ્ડિંગના કામકાજના ક્લાકો સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી છે. સંપર્ક કેન્દ્ર ઉતારુઓને સહાયરૂપ થવા સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી 905.874.2999 નંબર પર ચાલુ અને ઉપલબ્ધ છે.

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકો સહિત, બસોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવા, અને પોતાના હાથ અવારનવાર ધોવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

રૂટ અને સમયપત્રક માહિતી માટે, 905.874.2999 નંબર પર ફોન કોલ કરો અથવા વેબસાઇટ જુઓ, www.bramptontransit.com. રિયલ-ટાઈમ (વાસ્તવિક સમયે) આગામી બસ સંબંધિત માહિતી મેળવવા તમારા સ્માર્ટ ફોન કે અન્ય મોબાઈલ સાધન પર વેબસાઇટ nextride.brampton.ca જુઓ. અન્ય ફેરાના આયોજનને લગતા સાધનો માટે વેબસાઇટ www.triplinx.ca અથવા ગૂગલ મેપ્સ જુઓ.

બ્રેમ્પટન રિકોનેક્શન

તમામ મનોરંજન કાર્યક્રમો અને સગવડો ભાડે આપવાનું આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી રદ કરવામાં આવે છે. એકાઉન્ટ્સમાં કેડિટ્સ આપમેળે જમા કરવામાં આવશે. વધુ માહિતી માટે કૃપા કરી reconnects@brampton.ca ને ઈમેઈલ મોકલો.



સંપૂર્ણ બોડી સરકિટ વડે તંદુરસ્ત રહો, ઓરિગામી હાટ્સ બનાવતા શીખો, રેક એટ હોમ (Rec At Home) સાથે તમારી કેલિગ્રાફી આવડતો અને ઘણાં બધાંનો મહાવરો કરો, બ્રેમ્પટન રિક્રિએશન સ્ટાફે વિવિધ પ્રકારના વર્ચ્યુઅલ પ્રોગ્રામ્સ પ્રેમપૂર્વક બનાવ્યા છે! રેક એટ હોમ (Rec At Home) પ્લેટફોર્મમાં અહીંથી પ્રવેશ મેળવો, www.brampton.ca/recreation.

બ્રેમ્પટન લાઈબ્રેરી

બ્રેમ્પટનની તમામ પુસ્તકાલય શાખાઓ આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી બંધ કરવામાં આવી છે. અઠવાડિક રજાઓમાં મનોરંજન માટે, સ્ટ્રીમિંગ મૂવીસ અને મ્યુઝિક અજમાવી જુઓ, અથવા ઇબૂક વાંચો! અમારા ડિજિટલ ઉત્પાદો, કાર્યક્રમો અને સેવાઓ અંગે વધુ માહિતી માટે, વેબસાઈટ www.bramptonlibrary.ca જુઓ અથવા info@bramlib.on.ca ને ઈમેઈલ મોકલો.

બ્રેમ્પટન એનિમલ સર્વિસીસ

બ્રેમ્પટન એનિમલ શેલ્ટર વિક્ટોરિયા ડે વીકએન્ડ નિમિત્તે રવિવારે અને સોમવારે બંધ રહેશે.

એનિમલ કંટ્રોલ (પ્રાણી નિયંત્રણ) સોમવારથી શુક્રવાર સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી અને શનિવારે અને રવિવારે અને રજાઓના દિવસોમાં સવારે 8 થી સાંજે 6:30 વાગ્યા સુધી રસ્તા પર સક્રિય રહે છે, અને માત્ર નીચેના કોલ્સને પ્રતિભાવ આપશે:

- માંદા/ઈજા પામેલા/આક્રમક ઘરેલું પ્રાણીઓ અને વન્ય જીવોને લઈ જવા
- આક્રમક પ્રાણી
- દોડીને ભાગતા કૂતરા
- કૂતરું કરડવાની તપાસ
- બંધિયાર રખડતું કૂતરું લઈ જવા
- મરેલું પ્રાણી લઈ જવા

આ સિવાયના સમયે, એનિમલ કંટ્રોલ માત્ર ઈમરજન્સીમાં પ્રતિભાવ આપશે.

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca